

November 09, 2021

To,
The Manager
BSE Limited
P. J. Towers, Dalal Street
Mumbai – 400001

Subject: OFFER OPENING PUBLIC ANNOUNCEMENT AND CORRIGENDUM TO DETAILED PUBLIC STATEMENT TO SHAREHOLDERS OF KINTECH RENEWABLES LIMITED ('KRL' or 'TC' or TARGET COMPANY) IN TERMS OF REGULATION 18(7) OF SEBI (SUBSTANTIAL ACQUISITION OF SHARES AND TAKEOVERS) REGULATIONS, 2011

Dear Sir/Madam,


We, **Corporate Professionals Capital Private Limited** (hereinafter referred to as '**Manager to the Offer**'), had submitted on November 08, 2021 the copies of **Offer Opening Public Announcement and Corrigendum to Detailed Public Statement** made by us on behalf of **Mr. Gaurank Singhal and Mr. Aditya Singhal ('Acquirers')** to acquire upto 2,51,980 (Two Lacs Fifty One Thousand Nine Hundred and Eighty) Equity Shares of face value of INR 10.00/- each representing 25.20% of the total paid-up equity share capital of the Target Company at a price of INR 120 (Indian Rupees One Hundred and Twenty Only) per fully paid up equity share of Target Company, pursuant to, and in compliance with, amongst others, Regulation 3(1) and Regulation 4 of Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and subsequent amendments thereto for substantial acquisition of shares in the Target Company.

Please note that the Offer Opening Public Announcement and Corrigendum to Detailed Public Statement was published in following newspapers yesterday i.e., on November 08, 2021.

- Business Standard (English) - All Edition (including Ahmedabad edition)
- Business Standard (Hindi) - All Edition
- Pratahkal (Marathi) - Mumbai Edition
- Western Times (Gujarati) – Ahmedabad Edition

However, due to no publication in Ahmedabad city on November 08, 2021 (as confirmed by the publication agency), no Offer Opening Public Announcement and Corrigendum to Detailed Public Statement was published in Ahmedabad edition. The same got published today i.e., on November 09, 2021 in Business Standard (English) Ahmedabad edition and Western Times (Gujarati) Ahmedabad edition. Copies of these two newspapers is being submitted for your kind record.

For **Corporate Professionals Capital Private Limited**


(Manoj Kumar)

Partner & Head – M&A and Transactions



THE ASKA COOPERATIVE SUGAR INDUSTRIES LTD.
P.O. Nuagam (Aska)-761111, Ganjam District, Odisha
Ph.No.06822-273464, email:askasugar@yahoo.co.in
Website:www.askasugar.com

TENDER CALL NOTICE

No.PUR/1146 Dt.06.11.2021
The Aska Cooperative Sugar Industries Ltd., Aska invites sealed Tender paper from Manufacturer/Authorized dealers/Suppliers having GSTIN for supply of Burnt Lime, HDPE Bag, Boiler Fuels, Lubricants and Chemicals. Parties are requested to give their offer with detail terms & conditions on or before 05.00PM on 20.11.2021. Please visit our wcbbsite www.askasugar.com for details of the Tender Call Notice. **Managing Director**

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 05.05.2021 calling upon the Borrower Mr. Bimal Jayantibhai Ramani & Mr. Niranjan Ramniklal Bhimani (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 25,27,546.42 (Rs. Twenty Five Lakhs Twenty Seven Thousand Five Hundred Forty Six and Paise Forty Two Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 28,10,977.79 (Rs. Twenty Eight Lakhs Ten Thousand Nine Hundred Seventy Seven and Paise Seventy Nine Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Plot No. 238, Man Mandir Residency, RS No. 437, Khata No. 673, Kosmadi, Taluka: Ankleshwar, Bharuch, Bounded by: North: Plot No. 237, South: Plot No. 239, East: Society Road, West: Plot No. 224.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 30.04.2021 calling upon the Borrower Mr. Bharat Radheshyam Kesharwani and Mr. Yogeshbhai Batukbhai Kachhadiya (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 3,52,803.81 (Rs. Three Lakhs Fifty Two Thousand Five Hundred Three and Paise Eighty One Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 4,07,158.01 (Rs. Four Lakhs Seven Thousand One Hundred Fifty Eight and Paise One Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Flat No. 302, 3rd Floor, Anjali Residency Block No. 237, R.S. No. 226/2/B, Krishna Nagar, Vibhag-2, Talangpor Road, Sachin, Surat (Gujarat), Bounded by: North: Road, South: Passage, East: Flat No. 303, West: Road.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

SESHASAYEE PAPER AND BOARDS LIMITED
Regd. Office: Pallipalayam, Namakkal District, Cauvery RS PO, Erode 638 007.
Phone: (04288) 240221 to 240228 Fax No. (04288) 240229,
Email: investor@spbltd.com Web: www.spbltd.com
CIN: L21012Z1960PLC000364

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given that pursuant to Section 110 of the Companies Act, 2013, read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, the consent of the Members of the Company is being sought through Postal Ballot (including e-Voting), as set out in the Postal Ballot Notice dated 23rd October 2021, for:

- Appointment, by way of Ordinary Resolution, of Shri. K. Rajkumar, IFS, as a Nominee Director, liable to retire by rotation.

The Postal Ballot Notice will be available on the Company's website www.spbltd.com and on the website of the NSDL www.evoting.nsdl.com.

Postal Ballot Notice, in electronic form, has been sent to the shareholders on November 03, 2021, to their e-mail address registered with their Depository Participants (DP) (in case of electronic shareholding) / the Company's Registrar and Share Transfer Agents (RTA) (in case of physical shareholding).

Members whose names appear on the Register of Members / List of Beneficial Owners as on October 29, 2021 (Cut-off date) should be entitled for the e-voting. A person who is not a Member as on the cut-off date will treat this Notice for information purposes only.

In compliance with the requirements of the MCA Circulars and SEBI Circulars, physical copy of Postal Ballot notice, along with Postal Ballot Forms and prepaid business envelope, is not sent to the shareholders for this Postal Ballot and shareholders are required to communicate their assent or dissent through the remote e-voting system only.

In compliance with the provisions of Section 108 and 110 of the Companies Act, 2013 and the Rules made thereunder and in term of Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015, the Company has provided the facility to the Members to exercise their votes electronically through the Remote e-voting facility, arranged with National Securities Depository Limited (NSDL).

The e-Voting period commences on Sunday, the 07th November 2021 (09.00 AM) and ends on Monday, the 06th December 2021 (05.00 PM).

The Board of Directors has appointed Sri B Kalyanasundaram, Practising Company Secretary (Membership No. 672) as Scrutiniser for conducting the Postal Ballot Voting process, in a fair and transparent manner.

Members are advised to read carefully the voting process and instructions appended thereunder before casting their vote.

The result of voting by Postal Ballot will be announced on 07th December 2021 at 04.00 PM at the Registered office of the Company. The results of the voting by Postal Ballot will be posted on the website of the company www.spbltd.com and the results will be intimated to NSE / BSE Ltd. Additionally, the results of the voting by Postal Ballot will be posted on the website of NSDL at www.evoting.nsdl.com.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 2244 30 or send a request to evoting@nsdl.co.in, or contact Ms. Sarita Mote, Assistant Manager, National Securities Depository Ltd., at designated email IDs: evoting@nsdl.co.in to get your grievances on e-voting addressed.

(By Order of the Board)
For Seshasayee Paper and Boards Limited

(V PICHAI)
Place : Erode
Date : November 05, 2021 Deputy Managing Director & Secretary

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 30.04.2021 calling upon the Borrower Mrs. Anitaben Vithalbai Polra & Mr. Jaydeep Kumar Vithalbai Polra & Mr. Umeshkumar Dhirubhai Goti (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 14,14,562.53 (Rs. Fourteen Lakhs Fourteen Thousand Five Hundred Sixty Two and Paise Fifty Three Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 15,76,534.29 (Rs. Fifteen Lakhs Seventy Six Thousand Five Hundred Thirty Four and Paise Twenty Nine Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Plot No. 146, Ram Vatika, Vibhag-4, Sayan Road, Velanja. Bounded by: North: Society Road, South: Plot No. 145, East: Society Road, West: Plot No. 147.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 30.04.2021 calling upon the Borrower Mrs. Anitaben Vithalbai Polra & Mr. Jaydeep Kumar Vithalbai Polra & Mr. Umeshkumar Dhirubhai Goti (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 14,14,562.53 (Rs. Fourteen Lakhs Fourteen Thousand Five Hundred Sixty Two and Paise Fifty Three Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 28,10,977.79 (Rs. Twenty Eight Lakhs Ten Thousand Nine Hundred Seventy Seven and Paise Seventy Nine Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Plot No. 238, Man Mandir Residency, RS No. 437, Khata No. 673, Kosmadi, Taluka: Ankleshwar, Bharuch, Bounded by: North: Plot No. 237, South: Plot No. 239, East: Society Road, West: Plot No. 224.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 30.04.2021 calling upon the Borrower Mr. Bharat Radheshyam Kesharwani and Mr. Yogeshbhai Batukbhai Kachhadiya (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 3,52,803.81 (Rs. Three Lakhs Fifty Two Thousand Five Hundred Three and Paise Eighty One Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 4,07,158.01 (Rs. Four Lakhs Seven Thousand One Hundred Fifty Eight and Paise One Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Flat No. 302, 3rd Floor, Anjali Residency Block No. 237, R.S. No. 226/2/B, Krishna Nagar, Vibhag-2, Talangpor Road, Sachin, Surat (Gujarat), Bounded by: North: Road, South: Passage, East: Flat No. 303, West: Road.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

ADVERTISEMNET IN ACCORDANCE UNDER REGULATION 18(7) IN TERMS OF SEBI(SUBSTANTIAL ACQUISITION OF SHARES AND TAKEOVER) REGULATIONS, 2011, AS AMENDED AND CORRIGENDUM TO THE DETAILED PUBLIC ANNOUNCEMENT WITH RESPECT TO THE OPEN OFFER TO THE SHAREHOLDER OF

AKM LACE AND EMBROTEX LIMITED
CIN: (L17291DL2009PLC196375)
Registered Office: IX/6024, Ram Gali, Subhash Mohalla, Gandhi Nagar, East Delhi -110031
Tel No.: 011-49856126, 9899173704; Email Id.: akmlace@gmail.com;
Website: www.akmlace.co

This advertisement ("Offer Opening Public Announcement") and Corrigendum is being issued by Fast Track Finsec Private Limited ("Manager to the Offer") on behalf of Mr. Amar Jitendra Patwa (Acquirer 1) (PAN: AADPP5942K), Ms. Sangita Amar Patwa (Acquirer 2) (PAN: AADPP5943J) and Ms. Shah Shalvi Rajan (Acquirer 3) (PAN: EHGPS3036F), pursuant to Regulation 18(7) of Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulation, 2011, as amended ("SEBI (SAST) Regulation, 2011"/"Regulation"), in respect to the open offer letter to acquire upto 7,86,000 (Seven Lakh Eighty Six Thousand) Equity Shares of INR 10/- (Rupees Ten Only) each of AKM LACE and Embrotext Limited ("AKM LACE" or "the Target Company" or "TC") representing 26.09% of the Equity Share Capital of the Target Company on a fully diluted basis carrying voting rights. The Detailed Public Statement ("DPS") with respect to the Offer was published in Business Standard (English - All Edition), Business Standard (Hindi-All edition) and PrataKai (Mumbai edition) on September 13th, 2021 (Monday)

1. Offer Price:
The Offer Price is INR 10/- (Rupees Ten) per Equity Share. There has been no revision in the Offer Price.

2. Recommendations of the Committee of the Independent Directors of the Target Company
The Committee of the Independent Directors of the Target Company ("IDC") published its recommendations on the Offer on November 03, 2021 in the same newspapers where the DPS was published. Based on the review, IDC Members believe that the Offer is fair and reasonable in line with the SEBI (SAST) Regulations, 2011.

3. The offer is not a competing offer in terms of the Regulation 20 of SEBI (SAST) Regulations, 2011. There was no competing offer to the Offer and the last date for making such competing offer has expired. The offer is not conditional upon any minimum level of acceptance in terms of Regulation 13(1) of SEBI SAST Regulations, 2011.

4. Dispatch of Letter of Offer to the public shareholders
The dispatch of the Letter of Offer to all the Public Shareholders of the Target Company holding Equity Share on the Identified Date i.e. Friday, October 22, 2021, SEBI, vide its email, issued its comments on the Offer on October 29, 2021. The Identified Date was relevant only for the purpose of determining the Public Shareholders as on such date to whom the Letter of Offer was to be sent. It is clarified that all the Holders (registered or unregistered) of Equity Shares (except the Acquirers and PAC) are eligible to participate in the Offer any time during the Tendering Period. A copy of the Letter of Offer (which includes the Form of Acceptance -cum- Acknowledgment) is also available on the SEBI's website (www.sebi.gov.in).

5. Instructions to the Public Shareholders

- In case the shares are held in physical form
Public Shareholders holding Equity Shares in physical form may participate in the Open Offer through their respective Selling Broker by providing the relevant information and documents as mentioned in paragraph 8.2 (page 20) of the LoF.
- In case the shares are held in demat form
Public Shareholders who desire to tender their Equity Shares in the electronic / dematerialized form under the Offer would have to do so through their respective Selling Brokers by giving the details of Equity Shares they intend to tender under the Offer and as per the procedure specified in paragraph 8.3 (page 21) of the LoF.
- Procedure for Tendering the Shares in case of Non-Receipt of the Letter of Offer.
In case of non-receipt of the LoF, the Public Shareholders holding the Equity Shares may download the same from the websites of SEBI at www.sebi.gov.in, Manager to the Offer at www.ftfinsec.com and BSE at www.bseindia.com. Alternatively, they may participate in the Offer by providing their application in plain paper in writing signed by all shareholder(s), stating name, address, number of Equity Shares held, client ID number, DP name, DP ID number, number of Equity Shares tendered and other relevant documents and other relevant documents as mentioned in Paragraph 8.5 (Page 22) of the LoF.

6. Any other change suggested by SEBI in their comments to be incorporated
In terms of Regulation 16(1) of the SEBI SAST Regulations, 2011 the draft Letter of Offer was submitted to SEBI on September 21, 2021 (Draft Letter of Offer). On October 21, 2021, SEBI, vide its email, issued its comments on the Draft Letter of Offer. These comments have been incorporated in the Letter of Offer. These comments and other key changes (occurring after the date of the Public Announcement) have been incorporated in the LoF. These changes in the LoF include the following: (i) on page no. 2, updates to the schedule of major activities of the Open Offer, and consequential updates to the dates mentioned in the LoF; (ii) change of % from 26% to 26.09% at Page No. 01 and consequential updates in LoF; (iii) update details of Acquirers in para 4 (iv) update shareholding of directors at page no. 12 (v) update information in Target Company at Page No. 13 (vi) in page no. 15 Pre and Post offer shareholding Pattern of target company; (vii) in para 6.2.3 on pages 17 (viii) Documents of Inspection on page 24.

7. Any other material change from the Date of Public Announcement
There have been no material changes in relation to the Offer since the date of the PA.

8. Status of Statutory and Other Approvals

- As of the date of the LoF, to the best of the knowledge of the Acquirer and PACs, there are no statutory or other approvals required to complete the Offer.
- However, in case any statutory approvals are required by the Acquirer / the PACs at a later date before closure of the Tendering Period, the Offer shall be subject to such statutory approvals and the Acquirers shall make the necessary applications for such statutory approvals.
- NRI and OCB holders of the Equity Shares, if any, must obtain all requisite approvals required to tender the Equity Shares held by them in this Offer (including but not limited to, the approval from the RBI, since the Equity Shares validly tendered in this Offer will be acquired by a non-resident entity), if applicable, and submit such approvals along with the Form of Acceptance and other documents required to accept this Offer.
- Further, if the Public Shareholders who are not persons resident in India (including NRIs, OCBs, FIs and FPIs) had required any approvals (including from the RBI or any other regulatory body) at the time of the original investment, in respect of the Equity Shares held by them currently, they will be required to submit copies of such previous approvals along with the other documents required to be tendered to accept this Offer.
- If such approvals are not submitted, the Acquirer and the PACs reserve the right to reject such Equity Shares tendered pursuant to this Offer. If the Equity Shares are held under the general permission of the RBI, the non-resident Shareholders should state that the Equity Shares are held under such general permission and whether such Equity Shares are held on a repatriable basis or a non-repatriable basis

9. Schedule of Activities
The Schedule of Activities has been revised and the necessary changes have been incorporated in the LoF at all relevant places. The Revised Schedule of Activities is in compliance with the applicable provisions of SEBI (SAST) Regulations, 2011 and the same is as under:

Activity	Schedule	Revised Schedule
	Day and Date	Day and Date
Date of the Public Announcement	06.09.2021 (Monday)	06.09.2021 (Monday)
Date of publishing of the DPS	13.09.2021 (Monday)	13.09.2021 (Monday)
Last date of filing of the draft Letter of Offer with SEBI	20.09.2021 (Monday)	20.09.2021 (Monday)
Last date of Public Announcement for a Competing Offer(s)	11.10.2021 (Monday)	11.10.2021 (Monday)
Last date for receipt of comments from SEBI on the draft Letter of Offer (in the event SEBI has not sought clarification or additional information from the Manager to the Offer)	11.10.2021 (Monday)	21.10.2021 (Thursday)
Identified Date*	12.10.2021 (Tuesday)	22.10.2021 (Friday)
Last date by which Letter of Offer will be dispatched to the Public Shareholders whose name appears on the register of members on the Identified Date	21.10.2021 (Thursday)	29.10.2021 (Friday)
Last date by which the Committee of Independent Directors of the Board of Directors of the Target Company shall give its recommendations to the Public Shareholders of the Target Company for this Offer	22.10.2021 (Friday)	03.11.2021 (Wednesday)
Last date for Upward revision in Offer Price/ Offer Size	21.10.2021 (Thursday)	02.11.2021 (Tuesday)
Date of Publication of Offer opening Public Announcement in the newspaper in which DPS has been published	26.10.2021 (Tuesday)	08.11.2021 (Monday)
Date of commencement of Tendering Period ("Offer Opening Date")	27.10.2021 (Wednesday)	09.11.2021 (Tuesday)
Date of closure of Tendering Period ("Offer Closing date")	11.11.2021 (Thursday)	23.11.2021 (Monday)
Last date of communicating the rejection/ acceptance and completion of payment of consideration or refund of Equity Shares to the Public Shareholders of the Target Company	25.11.2021 (Thursday)	06.12.2021 (Monday)
Last Date for issue of post-offer advertisement	18.11.2021 (Thursday)	10.12.2021 (Friday)

*Identified Date is only for the purpose of determining the names of the shareholders as on such date to whom the Letter of Offer will be sent. It is clarified that all the Shareholders (registered or unregistered) of the Target Company (except the acquirer and the selling Shareholder) are eligible to participate in this offer any time during the tendering period of the Offer.

10. Other Information:

- The Acquirers accept full responsibility for the obligations of the Acquirers and the PACs as laid down in terms of the SEBI (SAST) Regulations and for the information (other than such information as has been provided or confirmed by the Target Company) contained in this Offer Opening Public Announcement cum Corrigendum.
- This Offer Opening Public Announcement cum Corrigendum would also be available on websites of SEBI at www.sebi.gov.in, Manager to the Offer at www.ftfinsec.com, and BSE at www.bseindia.com.

Issued by Manager of the Offer on behalf of the Acquirer:

Fastrack Finsec
Category-4 Merchant Banker

FAST TRACK FINSEC PRIVATE LIMITED
B-502, Statesman House, 148 Barakhamba Road, New Delhi - 110001
Telephone: +91-11-43029809.
Email: vikasverma@ftfinsec.com
Investor Grievance Email: investor@ftfinsec.com,
Website: www.ftfinsec.com
Contact Person: Mr. Vikas Kumar Verma
SEBI Reg. No: INM000012500,
CIN: U65191DL2010FTPC200381

For & On behalf of Acquirers

Acquirer 1	Acquirer 2	Acquirer 3
Sd/-	Sd/-	Sd/-
Mr. Amar Jitendra Patwa (PAN: AADPP5942K)	Ms. Sangita Amar Patwa (PAN: AADPP5943J)	Ms. Shah Shalvi Rajan (PAN: EHGPS3036F)

Date: November 07, 2021
Place: New Delhi

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 06.05.2021 calling upon the Borrower Mr. Trapasiya Jayeshkumar Pravinbhai & Mr. Trapasiya Rohitbhai Dhirubhai (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 16,01,743.63 (Rs. Sixteen Lakhs One Thousand Seven Hundred Forty Three and Paise Sixty Three Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 17,92,605.43 (Rs. Seventeen Lakhs Ninety Two Thousand Six Hundred Forty Three and Paise Forty Three Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Plot No. 127, Society Known as Shree Shubh Residency, Moje Gam Jolkha, Located on RS No. 192/2, Block No. 204, Taluka Kamrej, Dist. Surat. Bounded by: North: Plot No. 126, South: Plot No. 128, East: Society Road, West: Block No. 203.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 30.04.2021 calling upon the Borrower Mr. Jaysukhbhai Punabhai Sukhadiya (Borrower) & Mr. Kalpeshbhai Narshibhai Nayani (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 11,57,482.03 (Rs. Eleven Lakhs Fifty Seven Thousand Four Hundred Eighty Two and Paise Three Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 11,86,741.47 (Rs. Eleven Lakhs Eighty Six Thousand Seven Hundred Forty One and Paise Forty Seven Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Plot No. 79, Revenue Survey No. 213, 214, 217 and 271, Block No. 198, Ram Vatika Vibhag-3, Village: Velanga, Tal. Kamrej, Dist. Surat. Bounded by: North: Plot No. 78, South: Plot No. 80, East: Plot No. 94, West: Society Road.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

कॅनरा बँक Canara Bank Majura Gate Branch, Surat
A Government of India Undertaking
एन.एस.ए.सी. सिंडिकेट

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 30.04.2021 calling upon the Borrower Mr. Kantilal Bhabhabhai Savaliya & Mr. Vijaybhai Narshibhai Mungara (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 16,50,177.12 (Rs. Sixteen Lakhs Fifty Thousand One Hundred Seventy Seven and Paise Twelve Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this 03rd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 17,21,205.42 (Rs. Seventeen Lakhs Twenty One Thousand Two Hundred Five and Paise Forty Two Only) as on 11.10.2021 and interest thereon.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of EMT of Plot No. 237, Ram Vatika Vibhag-2, Village: Velanga, Taluka: Kamrej, Dist. Surat. Bounded by: North: Society Road, South: Plot No. 238, East: Plot No. 246 & 247, West: Society Road.

Date: 03.11.2021 | Place: Surat Authorised Officer, Canara Bank

OPENING PUBLIC ANNOUNCEMENT AND CORRIGENDUM TO THE DETAILED PUBLIC STATEMENT UNDER REGULATION 18(7) OF SEBI (SUBSTANTIAL ACQUISITION OF SHARES AND TAKEOVERS) REGULATIONS, 2011 ('SEBI (SAST) REGULATIONS, 2011')

FOR THE ATTENTION OF THE SHAREHOLDERS OF KINTECH RENEWABLES LIMITED

Registered Office: Kintech House, 8, Shivajik Plaza, Opp. AMA, IIM Road, Ahmedabad, Gujarat - 380015, India-2941056
CIN: L40105GJ1985PLC013254, Tel. No.: +91-44-2941056 Fax. No.: NA
E-mail: info@kintechrenewables.com / cs@kintechrenewables.com
Website: www.kintechrenewables.com

Open Offer for acquisition of 2,51,980 Equity Shares from the Shareholders of Kintech Renewables Limited ("Target Company") by Mr. Gaurank Singhal and Mr. Aditya Singhal (hereinafter referred to as "Acquirers")

This Offer Opening Public Announcement and Corrigendum to the Detailed Public Statement is being issued by Corporate Professionals Capital Private Limited, for and on behalf of Mr. Gaurank Singhal and Mr. Aditya Singhal pursuant to Regulation 18(7) of SEBI (SAST) Regulations, 2011 in respect of the Takeover Open Offer to acquire substantial shares and control over Kintech Renewables Limited (hereinafter referred to as 'KRL' / 'Target Company'). The Detailed Public Statement ("DPS") with respect to the aforementioned offer was made on August 26, 2021, Thursday in Business Standard (English) (All Editions), Business Standard (Hindi) (All Editions), PrataKai (Marathi) (Mumbai Edition) and Western Times (Gujarati) (Ahmedabad Edition).

- Offer Price ₹ INR 120 (Indian Rupees One Hundred and Twenty Only) per fully paid up equity share of the Target Company.
- Independent Directors Committee (IDC) recommends that the Offer Price being in compliance with the applicable regulations can be considered as fair and reasonable. The recommendation of IDC was published in aforesaid newspapers on November 02, 2021, Tuesday.
- This is not a competing offer.
- Letter of Offer (LOO) has been dispatched to all the equity shareholders of 'KRL' whose names appear in its Register of Members on October 22, 2021, Friday the Identified Date.
- The LOF alongwith the Form of Acceptance cum Acknowledgement is also available on SEBI's website www.sebi.gov.in, BSE's website www.bseindia.com and the website of Manager to the Offer www.corporateprofessionals.com and shareholders can also apply by downloading such forms from the website. Further, in case of non-receipt/non-availability of the Form of Acceptance, the application can be made on plain paper along with the following details:
 - In case of Equity Shares held in physical form-
The Public Shareholders who are holding physical Equity Shares and intend to participate in the Open Offer shall approach the Selling Broker. The Selling Broker should place bids on the Designated Stock Exchange platform with relevant details as mentioned on physical share certificate(s). The Selling Broker(s) shall print the TRS generated by the Exchange Bidding System. TRS will contain the details of order submitted like Folio No., Certificate No., Dist. Nos., No. of Equity shares etc and such equity shareholders should note that physical Equity Shares will not be accepted unless the complete set of documents as mentioned in Para 8.12 is submitted. Acceptance of the physical Equity Shares for the Open Offer shall be subject to verification by the Registrar & Transfer Agent (RTA). On receipt of the confirmation from the RTA, the bid will be accepted otherwise it would be rejected and accordingly the same will be depicted on the exchange platform.
 - In case of